

સને-૨૦૦૫ માં અડાજણ વિસ્તારમાં રીક્ષા ચાલકના થયેલ અન-ડીટેક્ટ મર્ડરનો ભેદ ઉકેલી, ત્રણ આરોપીઓને

ઝડપી પાડતી સુરત શહેર કાઈમબ્રાંચ :-

તા.૨૬/૦૧/૨૦૦૫ ના રોજ એલ.પી.સવાણી સાંઈ રચના રો-હાઉસ રોડ ઉપર રાત્રીના ૧:૪૫ પહેલા રીક્ષા નંબર GJ-05-XX-2527 ના ચાલકની કોઈ અજાણ્યા ઈસમે ગળામાં, છાતીમાં તિક્ષણ હથીયારના ઘા મારી હત્યા કરેલ હોય, રાંદેર પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૩૨/૨૦૦૫ ઈ.પી.કો. કલમ ૩૦૨ વિ. થી નોંધી તપાસ દરમ્યાન. મરણ જનારની ઓળખ અશરફખાન કાદરખાન પઠાણ ઉ.વ-૨૫ રહે-મેનાનગર ઝુપડપટ્ટી, સ્વામીનારાયણ મંદિર પાસે, અડાજણ, સુરતના તરીકેની થયેલ.

નાયબ પોલીસ કમિશ્નર તથા મદદનીશ પોલીસ કમિશ્નર કાઈમ બ્રાંચની સુચના મુજબ જુના અનડીટેક્ટ મર્ડરના ગુનાઓની માહિતી મેળવી વર્ક આઉટ કરી ગુનાનો ભેદ ઉકેલવા કાઈમ બ્રાંચના પો.સ.ઈ. એમ.એસ.ત્રિવેદી તથા તેઓની ટીમના માણસોને અન-ડીટેક્ટ મર્ડર વિશે માહિતી મેળવી ભેદ ઉકેલવા જણાવેલ દરમ્યાન HC વિકાશભાઈ વિશ્વાસરાવ તથા PC મહેન્દ્રસિંહ જીતુભાઈને મળેલ બાતમી આધારે અડાજણ બમ્બાગેટ ભગવતી નગર, સાંઈ મંદિર બસ સ્ટેશન પાસેથી (૧) સુખદેવ એકનાથભાઈ સૈંદાણે ઉ.વ-૩૬ રહે-બીલ્ડીંગ નં.૬, એસ.એમ.સી આવાસ, સંત તુકારામ વિભાગ-૬, પાલનપુર જકાતનાકા, સુરત (૨) કિરણ પ્રકાશભાઈ પટેલ ઉ.વ-૩૭ રહે-શ્રીજી નગરી, ઝઘડીયા ચોકડી પાસે, ભેંસાણ રોડ પાણીની ટાંકી પાસે, રાંદેર સુરત (૩) જીતુ ઉર્ફે કાળુ નારાયણભાઈ રાહોડ ઉ.વ-૩૩ રહે- મકાન નં.૪૭૧, ધોબીનો ખાંચો, સ્ટાર બજારની પાછળ એલ.પી.સવાણી રોડ, નાઓને ઝડપી પુછપરછમાં મરણ જનાર અશરફખાન કાદરખાન પઠાણે રાજુ નેપાલી પાસેથી અંગત કામ માટે રૂપીયા લીધેલા જે રાજુએ પરત માંગતા મરણ જનારે તેની સાથે બોલાચાલી કરેલ જેથી તે વાતનું મનદુખ રાજુ નેપાલીએ રાખેલ. રાજુ નેપાલીએ પકડાયેલ ઉપરોક્ત ત્રણ આરોપી તથા પિંટુ @ ભાસ્કર વેડુ જાદવને આ વાત કરેલ અને તમામે મરણ જનારને રાગદ્વેષ રાખી સબક શીખડાવવા માટે કોઈ એકાંત જગ્યા પર લઈ જઈ માર મારી ડરાવાની યોજના બનાવેલ. ત્યાર બાદ લગભગ પંદર દિવસ પછી આરોપી રાજુ નેપાલીએ મરણ જનારને બોલાવેલ અને રાજુ નેપાલી તથા જીતુ ઉર્ફે કાળુ નારાયણભાઈ રાહોડ તેની રીક્ષા ભાડે કરી મરણ જનારને બનાવ વાળી જગ્યાએ લઈ જઈ અગાઉથી નક્કી કરેલ આયોજન મુજબ અન્ય આરોપીઓ સ્કુટર પર પર આવી રીક્ષાની આજુ બાજુ ગોઠવાઈ મરણ જનારને કેમ દાદાગીરી કરે છે તેમ બોલાચાલી કરી ગડદા-પાટુનો માર મારી પકડી રાખી ગળાના ભાગે તથા શરીર પર અન્ય જગ્યાએ ચાકુથી જીવલેણ ઈજાઓ કરી ત્યાંથી ભાગી ગયેલ. હોવાની હકિકત જણાવેલ છે. આરોપીઓને આગળની વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશન સોંપાવા માટે તજવીજ કરવામાં આવેલ છે.

કતારગામ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડતી

કતારગામ પોલીસ

કતારગામ પો.સ્ટે. 1 ગુ.ર.નં. ૧૪૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબના કામે તા-૨૯/૦૫/૨૦૧૮ ના કલાક ૨૩/૦૦ થી તા. ૩૦/૦૫/૨૦૧૮ ના કલાક ૫/૦૦ દરમ્યાન ફરીયાદીશ્રીના મકાનમાંથી આશરે રોકડા રૂ-૧૮૦૦૦/- તથા સોનાની આશરે ત્રણ ગ્રામની બુટ્ટી જેની હાલની કિ.રૂ. આશરે ૧૦,૦૦૦/- ની તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૮૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૨૮,૮૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે ગુન્હાના આરોપી (૧) સુનીલભાઇ રાજુભાઇ પાટીલ ઉ.વ-૨૦ ધંધો-બેકાર રહે ફ્લેટ નં-૧૦૧, ડાયમંડ એપાર્ટમેન્ટ કુબેરપાર્ક સોસાયટી, વેડરોડ, કતારગામ, સુરત મુળગામ-આકોલા મહારાષ્ટ્ર (૨) કલ્પેશભાઇ પાલજીભાઇ વાઢેલ ઉ.વ-૨૦ ધંધો-હીરામજુરી રહે-ઘર.નં-૧૭૮, બહુચરનગર સોસાયટી, વેડ રોડ કતારગામ, સુરત મુળગામ-તણસા તા-જી-ભાવનગર (૩) ભાર્ગવ રમેશભાઇ મારુ ઉ.વ-૧૮ રહે ફ્લેટ ૧૬૪,૧૬૫, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ ત્રીજા માળે બહુચરનગર સોસા વેડરોડ, કતારગામ, સુરત મુળગામ-વરતેજ તા-જી-ભાવનગરનાઓ ત્રણેય આરોપી અટક કરવામાં આવેલ છે.

પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા ખંડણીખોરના આરોપીઓને ગણતરીના કલાકમાં

ઝડપી પાડતી પુણા પોલીસ.

પુણા પો.સ્ટે. 1 ગુ.ર.નં. ૧૮૭/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૬૫,૩૮૪,૩૪૨,૩૨૩,૨૯૪ (ખ), ૫૦૬(૨) તથા ગુજરાત નાણા ધીરધાર કરવા બાબત એક્ટ સને ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨,(ક) (ઘ) મુજબ

પુણા પો.સ્ટે. વિસ્તારમાં “અ” પડત ગુન્હા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રો.પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એચ.મારુ તથા બીજા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ASI સુનીલ નામદેવ તથા અ.પો.કો. અનંત દિનેશચંદ્ર નાઓના સંયુક્ત બાતમીદાર મારફતે સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપી નામે (૧) કીરીટ દેવેન્દ્રભાઇ રાવળ ઉ. ૨૮ રહે. ૩૭/બી, ત્રીકમનગર, ચન્દ્ર કોલોની પરમહસ સોસા. ની સામે વરાછા સુરત (૨) ફારુક ઉર્ફે ફારુક વાન નારીસઅલી સૈયદ ઉ. ૨૭ રહે. ૩૭૬/બી ગલી નં. ૧૭, નવા કમેલા સંજયનગર ઝુપડપટ્ટી સહારા દરવાજા સુરતનાઓ રાજીવનગર ઝુપડપટ્ટી થઇ, આજંણા ફાર્મ તરફ જવાના હોય, તેવી અંગત બાતમી હકીકત મળતા સંજયનગર ખાડી પાસે પુણા પો.સ્ટે.ના પોલીસ માણસોની વોચ ગોઠવી ઉપરોક્ત નામવાળા આરોપીઓ પોતાની મોટર સાઇકલ લઇ પસાર થતાં તેમને ઉભા રાખી પુછપરછ કરતા બન્ને આરોપીઓ ઉપરોક્ત ગુન્હાની હકીકત જણાવતા ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરેલ.

ઉપરોક્ત કામગીરી પુણા પો.સ્ટે.ના સ્ટાફના પ્રો.પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એચ.મારુ તથા એ.એસ.આઇ સુનિલભાઇ નામદેવ તથા એ.એસ.આઇ નરેશ ગમનલાલ તથા અ.હે.કો ભરતભાઇ ગકુરભાઇ તથા અ.હે.કો. રાઘેશ્યામ કીશનભાઇ તથા અ.પો.કો.અનંત દિનેશચન્દ્ર તથા અ.પો.કો.પ્રકાશ મોતીરામ તથા સંજય તળજાભાઇ અ.પો.કો. દીલીપ દેવેન્દ્ર નાઓ ટીમ વર્કથી કરવામાં આવેલ છે.